



Registered & Corporate Office:
AMANTA HEALTHCARE LIMITED
8th Floor, Shaligram Corporates, CJ Marg,
Ambli, Ahmedabad-380058, Gujarat, INDIA.
Tel.: 079 – 67777600
Email: info@amanta.co.in
Website: www.amanta.co.in

CIN: L24139GJ1994PLC023944

February 12, 2026

To, Sr. General Manager Listing Department BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001. Scrip Code: 544502	To, Sr. General Manager National Stock Exchange of India Limited Exchange Plaza, C-1, Block G Bandra Kurla Complex Bandra (E), Mumbai – 400 051. Trading Symbol: AMANTA
--	---

Dear Sir/Madam,

Sub: Intimation to Stock Exchanges regarding publication of Financial Results in Newspapers

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 please find enclosed copies of newspaper advertisements dated February 12, 2026 published in Business Standard (English Newspaper) and Jai hind (Gujarati Newspaper), regarding Financial Results of the Company for the quarter ended December 31, 2025 which were approved by the Board of Directors, at its meeting held on February 10, 2026.

Further, in terms of Regulation 46 of the Listing Regulations, the aforesaid financial results are also available on the website of the Company (www.amanta.co.in).

Thanking you,

Yours sincerely,

For AMANTA HEALTHCARE LIMITED

NIKHITA DINODIA
Company Secretary & Compliance Officer


Encl.: As above

CHANGE OF NAME

I, Army No **10359803A** Rank Ex L/NK Name **JAGADISHA N D** resident of No 15/4th floor Nagadevanahalli Bangalore-560056 do hereby declare that I want to change date of birth of my dependent (Name) **PUTTA NANJAMMA** from **16/06/1955 to 01/01/1958**, vide affidavit dated 09-02-2026, sworn before Prl. Senior Civil Judge & JMFC, Channarayapatna.

CHANGE OF NAME

I, Army No. **10359803A** Rank L/NK Name **JAGADISHA N D** resident of No 15/4th floor, Nagadevanahalli Bangalore-560056 do hereby that I want to change name of my dependnt from **DHARMA PRAKASH N to N DHARMA PRAKASH** and I want to change date of birth of my dependent (Name) **N DHARMA PRAKASH** from **23/05/1945 to 05/03/1945**, vide affidavit dated 09-02-2026, sworn before Prl. Senior Civil Judge & JMFC, Channarayapatna.



सेंट्रल बैंक ऑफ इंडिया
Central Bank of India

Short Notice Inviting Tenders
Central Bank of India invites e-bids for Bid No. **GeM/2026/B/7224493** for **"RFP for AMC of CISCO Hardware and Peripherals"**. Deadline for Tender Submission on GeM portal is **05.03.2026** upto 15:00Hrs.
For details, please visit our Bank's Website: **www.centralbank.bank.in**
Chief Manager IT

बैंक ऑफ इंडिया
Bank of India

Head Office

Transaction Monitoring and KYC/AML Department
CORRIGENDUM

Bank of India invites Open Tender for conducting feedback exercise for our field functionaries. For this purpose, RFP has been floated and uploaded to our bank website on 21.01.2026. The last date for submission of bid was 10.02.2026, 5.00 p.m. which is now been extended up to 21.02.2026 and opening of bid is scheduled on 24.02.2026. For more details kindly visit Bank of India official website **www.bankofindia.bank.in** under **BOI>Important Links>Tender**.


Authum Investment & Infrastructure Limited
CIN No.: L51109MH1982PLC319008 ,Website: www.authum.com, Email: secretarial@authum.com, Ph: 022-67472117
Registered Office : 707, Raheja Centre, Free Press Journal Marg, Nariman Point, Mumbai - 400 021.
Corporate Office : The Ruby, 11th Floor, North-West Wing, Plot 29, Senapati Bapat Marg, Dadar (W), Mumbai - 400028.

EXTRACT OF STATEMENT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND PERIOD ENDED DECEMBER 31, 2025
(Rs.in Crores)


Sr. No.	Particulars	Standalone		Consolidated	
		Quarter Ended	Nine Months Ended	Quarter Ended	Nine Months Ended
		31.12.2025 (Unaudited)	31.12.2024 (Unaudited)	31.12.2025 (Unaudited)	31.12.2025 (Audited)
1.	Total Income from Operations (Net)	446.37	618.56	2,264.05	477.70
2.	Net Profit / (Loss) for the period(before Tax,Exceptional and/or Extraordinary items)	285.62	620.18	1,962.36	278.40
3.	Net Profit / (Loss) for the period before tax(after Exceptional and/or Extraordinary items)	285.62	620.18	1,962.36	278.40
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	168.02	545.18	1,873.93	161.47
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax)) and Other Comprehensive Income	-330.97	573.14	1,249.60	-337.47
6.	Equity Share Capital*(face value of the share : Rs. 1 each)	16.98	16.98	16.98	16.98
7.	Earnings Per Share (Face Value of Rs.1/- Per Share) (for continuing and discontinued operations)	1. Basic : 9.89 2. Diluted : 9.89	32.10 32.10	110.33 110.33	9.51 9.51

Note:
1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock exchange (www.bseindia.com & www.nseindia.com) & on Company's website (www.authum.com).

By Order of Board
For Authum Investment & Infrastructure Limited
Sd/-
Amit Dangi
Whole Time Director
DIN: 06527044



Date: 11th February, 2026
Place: Mumbai



GOVERNMENT OF TAMIL NADU
FINANCE DEPARTMENT,
CHENNAI-9

Dated : February 11, 2026
PRESS COMMUNIQUE

It is notified for general information that the outstanding balance of **8.53% Tamil Nadu SDL, 2026** issued in terms of the Government of **Tamil Nadu**, Finance Department, Notification **No.306(L)/W&M-II/2016**, dated **March 03, 2016** will be repaid at par on **March 09, 2026** with interest due up to and including **March 08, 2026**. In the event of a holiday being declared on the aforesaid date by any State Government under the Negotiable Instruments Act, 1881, the loan will be repaid by the paying offices in that State on the previous working day. No interest will accrue on the loan from and after **March 09, 2026**.

2. As per sub-regulation 24(2) and 24(3) of Government Securities Regulations, 2007 payment of maturity proceeds to the registered holder of Government Security held in the form of Subsidiary General Ledger or Constituent Subsidiary General Ledger account or Stock Certificate shall be made by a pay order incorporating the relevant particulars of his bank account or by credit to the account of the holder in any bank having facility of receipt of funds through electronic means. For the purpose of making payment in respect of the securities, the original subscriber or the subsequent holders of such a Government Securities, as the case may be, shall submit to the Bank or Treasury and Sub-Treasury or branch of State Bank of India, where they are enfaced / registered for payment of interest, as the case may be, the relevant particulars of their bank account.


3. However, in the absence of relevant particulars of bank account/mandate for receipt of funds through electronic means, to facilitate repayment on the due date, holders of **8.53% Tamil Nadu SDL, 2026** should tender their securities at the Public Debt Office, 20 days in advance. The securities should be tendered for repayment, duly discharged on the reverse thereof as under:-
"Received the Principal due on the Certificate".

4. It should be particularly noted that at places where the treasury work is done by a branch of the State Bank of India, the securities, if they are in the form of Stock Certificates, should be tendered at the branch of the bank concerned and not at the Treasury or Sub-Treasury.

5. Holders who wish to receive payment at places other than those where the securities have been enfaced for payment should send them duly discharged to the Public Debt Office concerned by Registered and Insured Post. The Public Debt Office will make payment by issuing a draft payable at any Treasury/Sub-Treasury or branch of State Bank of India conducting Government Treasury work in the State of **Tamil Nadu**.

T.UDHAYACHANDRAN,
Additional Chief Secretary to
Government of Tamil Nadu,
Finance Department.

DIPRI/ 174 /DISPLAY/2026



AMANTA HEALTHCARE LIMITED
CIN: L24139GJ1994PLC023944


Regd. Office: 8th Floor, Shaligram Corporates C.J. Marg, Ambli, Ahmedabad - 380058, Gujarat, India.
Website: www.amanta.co.in, **E-mail:** info@amanta.co.in, **Tel:** +91 79 6777 7600

State of Unaudited Financial Results For The Quarter And Nine Months Ended On December 31, 2025
(₹ in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended			Nine Months Ended		Year Ended
		31.12.2025 (Unaudited)	30.09.2025 (Unaudited)	31.12.2024 (Unaudited)	31.12.2025 (Unaudited)	31.12.2024 (Unaudited)	31.03.2025 (Audited)
1	Total income from operations	7,448.74	7,088.73	6,781.47	21,068.18	20,264.55	27,470.82
2	Net Profit for the period before tax	630.36	227.78	552.91	1,350.80	819.17	1,470.69
3	Net Profit for the period after tax	462.89	120.75	428.14	934.36	617.65	1,050.07
4	Total comprehensive income / (Loss) for the period (comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	452.85	110.73	423.11	904.26	592.99	1,009.95
5	Paid up equity share capital (F.V. of Rs. 10/- each)	343.36	343.36	282.70	343.36	282.70	282.70
6	Reserves excluding revaluation reserves as per balance sheet of previous accounting year						6,755.89
7	Earnings per share (of Rs. 10/- each) (not annualised) Basic (Rs.) & Diluted (Rs.)	1.35 0.35		1.51	2.72	2.18	3.71

NOTE
1 The above financial results are prepared in compliance with Indian Accounting Standard ("Ind AS") as notified under section 133 of the Companies Act, 2013 ("the Act") [Companies (Indian Accounting Standards) Rules, 2015], as amended. The above financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on February 10, 2026.
2 The Company operates only in one business segment i.e. Manufacturing and sale of pharmaceutical products including contract manufacturing services provided to customer which constitutes single reportable segment in accordance with the requirements of Ind AS 108 "Operating Segments".
3 "On November 21, 2025, the Government of India notified the four consolidated Labour Codes, replacing several existing labour laws. Based on the draft rules and the guidance currently available, the Company has evaluated the impact of the revised definition of wages on its employee benefit obligations in accordance with Ind AS 19. Following this assessment the incremental impact arising from the implementation of the Labour Codes is not material to its financial performance. The Company will continue to monitor the finalisation of the relevant Central and State Rules and will recognise additional impact, if any, in the period in which such Rules or related clarifications are notified."
4 The above is the extract of detailed format of Financial Results for the Quarter and nine months ended December 31, 2025, filed with the Stock Exchanges under regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Financial Results is available on the website of BSE (www.bseindia.com), NSE (www.nseindia.com) and Company's website viz. www.amanta.co.in. and can also be accessed through the QR code given below.

Place: Ahmedabad
Date: February 10, 2026



For Amanta Healthcare Limited
Sd/-
Bhavesh Patel
Chairman & Managing Director (DIN: 00085505)


HIMADRI CREDIT & FINANCE LIMITED
CIN : L65921WB1994PLC062875
Regd. Off : 23A, Netaji Subhas Road, 8th Floor, Kolkata - 700 001.
Email: hcl@himadri.com, Website: www.himadricredit.in Ph No: (033) 2230-4363/ 9953

Extract of Unaudited Financial Results for the quarter and nine months ended December 31, 2025
(Rs. in Lacs)

Sr. No.	Particulars	Quarter Ended			Year to Date Ended		Year Ended
		31.12.2025 (Unaudited)	30.09.2025 (Unaudited)	31.12.2024 (Unaudited)	31.12.2025 (Unaudited)	31.12.2024 (Unaudited)	31.03.2025 (Audited)
1	Total income	70.63	70.90	61.20	220.28	301.13	368.87
2	Net profit / (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	63.80	64.10	54.11	200.93	282.33	341.79
3	Net profit / (loss) for the period after tax (before exceptional and/or extraordinary items)	44.49	48.05	38.05	147.25	107.12	151.46
4	Net profit / (loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	44.49	48.05	38.05	147.25	107.12	151.46
5	Total comprehensive income for the period/year (comprising net profit after tax and other comprehensive income after tax)	650.03	(866.79)	(946.55)	1,034.63	4,336.70	2,327.02
6	Paid up equity share capital	300.02	300.02	300.02	300.02	300.02	300.02
7	Other equity						10,473.39
8	Earnings per equity share (before and after extraordinary items) (of ₹10/- each) (not annualised) : Basic & diluted (₹)	1.48	1.60	1.27	4.91	3.57	5.05


NOTES :-
1) The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 11th February 2026. The Statutory Auditor have carried out a limited review on the above financial results for the quarter and nine months ended 31 December 2025.
2) The Company is primarily engaged in the business of investing and financing and accordingly there are no separate reportable segment as per Ind AS - 108 "Operating Segment".
3) The above is an extract of the detailed format of Un-audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Financial Results are available on the websites of Stock Exchanges at www.cse-india.com and on the Company's website at www.himadricredit.in.

On behalf of the Board of Directors
Sd/-
ANURAG CHOUDHARY
Managing Director
DIN: 00173934



Place: Kolkata
Dated : The 11th Day of February, 2026

ESAB INDIA LIMITED
CIN No. L29299TN1987PLC058738
Regd Office: Plot No. 13, 3rd Main Road, Industrial Estate, Ambattur, Chennai - 600 058
Telephone No. 044-42281100 email id : investor.relations@esab.co.in




Extract of Statement of Unaudited Financial Results for the quarter and nine months ended December 31, 2025
(₹ In Lakhs (Except EPS))


SI No	Particulars	Quarter ended December 31, 2025	Quarter ended September 30, 2025	Quarter ended December 31, 2024	Nine months ended December 31, 2025	Nine months ended December 31, 2024	Year ended March 31, 2025
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations	37,990	38,389	34,075	111,669	101,148	138,125
2	Net Profit for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	7,183	7,012	5,452	19,705	17,319	23,572
3	Net Profit for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	5,818	10,103	5,452	21,431	17,319	23,572
4	Net Profit for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	4,300	7,920	4,038	16,314	12,799	17,542
5	Total Comprehensive income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4,278	7,915	4,038	16,283	12,799	17,524
6	Equity Share Capital	1,539	1,539	1,539	1,539	1,539	1,539
7	Other Equity	-	-	-	-	-	34,586
8	Earning Per Share (of Rs 10/each) (for continuing and discontinued operations)						
	- Basic	27.94	51.46	26.24	106.01	83.16	113.98
	- Diluted	27.94	51.46	26.24	106.01	83.16	113.98

Note:
The above is an extract of the detailed Statement of Financial Results for the quarter and nine months ended December 31, 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The same would be available on the Company's website www.esabindia.com and on the website of the Stock Exchanges - BSE Limited and National Stock Exchange of India Limited.

Chennai
February 10, 2026



For ESAB India Limited
Rohit Gambhir
Managing Director



Coromandel Engineering Company Limited
CIN: L74910TN1947PLC000343
Registered and Corporate Office: 'BASCON FUTURA' No.10/2, Old No. 56L, Venkatanarayana Road, T. Nagar, Chennai - 600 017.
Email: general@cec.coromandel-group.com Website: www.coromandeleengg.com


EXTRACT OF THE UN-AUDITED FINANCIAL STATEMENTS FOR THE QUARTER & NINE MONTHS ENDED DECEMBER 31, 2025
(Rs. In Lakhs except EPS)

PARTICULARS	Quarter ended			Nine months ended		Year ended
	31 st Dec 2025	30 th Sep 2025	31 st Dec 2024	31 st Dec 2025	31 st Dec 2024	31 st March 2025
	Unaudited			Unaudited		Audited
Total Income from Operations	616.16	1344.30	668.35	2819.48	2422.55	3128.89
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or extraordinary items)	4.08	3.39	54.24	13.80	(399.69)	(95.98)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items)	4.08	3.39	54.24	13.80	(399.69)	(95.98)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items)	4.08	3.39	67.24	(65.03)	(237.77)	41.49
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4.08	3.39	67.24	14.49	(237.77)	277.71
Paid-up Equity Share capital (Face Value of Rs.10 per share)	3,488.34	3,488.34	3,323.36	3,488.34	3,323.36	3,323.36
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.						(2,934.41)
Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -						
Basic : (Rs.)	0.00	0.00	0.20	(0.02)	(0.72)	0.12
Diluted : (Rs.)	0.00	0.00	0.20	(0.02)	(0.72)	0.12

1. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 11th February 2026.

2. The above is an extract of detailed format of un-audited Financial results for the Quarter and Nine months ended 31st December 2025 filed with Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the website of the stock exchange (www.bseindia.com) and Company's website (https://www.coromandeleengg.com/). The same can be accessed by scanning the QR Code.

Place: Chennai
Date : 11th February 2026







For Coromandel Engineering Company Limited
G V Manimaran
Chairman & Managing Director
DIN: 09707546

SANDHAR
Growth. Motivation. Better Life

SANDHAR TECHNOLOGIES LIMITED
CIN: L74999DL1987PLC029553
Regd. Office: B - 6/20, L.S.C. Safdarjung Enclave, New Delhi 110029

Tel: 0124 - 4518900
E-mail: investors@sandhar.in
Website: www.sandhargroup.com



FOSTERING INNOVATION AND GROWTH

***consolidated nine months YoY**


EXTRACT OF CONSOLIDATED AND STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2025
(₹ in lakhs, except earning per share)

Sr. No.	Particulars	Consolidated				Standalone			
		Quarter ended		Nine Months ended		Quarter ended		Nine Months ended	
		31 December 2025	31 December 2024	31 December 2025	31 March 2025	31 December 2025	31 December 2024	31 December 2025	31 March 2025
		Un-audited	Un-audited	Un-audited	Audited	Un-audited	Un-audited	Un-audited	Audited
1	Revenue from Operations	118,463.76	97,368.74	354,509.97	388,450.22	73,703.51	73,973.90	227,018.15	291,303.56
2	Net Profit for the period (before Tax, exceptional items and share of profit in joint ventures)	4,498.51	3,808.18	17,370.73	17,257.79	4,638.13	4,857.90	17,563.81	18,309.95
3	Net Profit for the period (before Tax after exceptional items and share of profit in joint ventures)	4,474.00	4,184.94	17,673.62	18,459.36	4,460.12	4,857.90	17,385.80	18,614.28
4	Net Profit for the period (after Tax, exceptional items and share of profit in joint ventures)	3,344.70	2,994.77	13,483.55	14,164.24	3,276.00	3,519.94	13,274.59	13,962.71
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the Period after Tax and Other Comprehensive Income/ (Loss) after Tax)	3,209.55	2,690.05	14,345.22	14,227.13	3,285.30	3,503.02	13,857.24	13,847.64
6	Equity Share Capital	6,019.07	6,019.07	6,019.07	6,019.07	6,019.07	6,019.07	6,019.07	6,019.07
7	Total Reserves				107,911.05				108,636.24
8	Earnings Per Share (Face value of Rs. 10/- per share) (not annualised for quarter/ nine months)								
	1. Basic:	5.56	4.97	22.40	23.53	5.44	5.85	22.05	23.20
	2. Diluted:	5.56	4.97	22.40	23.53	5.44	5.85	22.05	23.20

Note:
a) The above is an extract of the detailed format of Quarter and Nine Months ended 31 December 2025 of Consolidated and Standalone Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and Nine Months ended Financial Results are available on the websites of the BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively and on Company's website at www.sandhargroup.com.

For Sandhar Technologies Limited

JAYANT DAVAR
Executive Chairman (Executive Director) & Chief Executive Officer
DIN: 00100801



Place: Gurugram (Haryana)
Date: 11 February 2026

એપેસ્ટીનનું ભુત અમેરિકાથી લઈ યુરોપ સુધી રાજકીય તોફાન સર્જે છે

માઈક્રોસોફ્ટના વડા બીલ ગેટ્સ અફસોસ કરે છે કાશ તેઓ કદી એપેસ્ટીનની પાર્ટિમાં ગયા ન હોત. વિશ્વભરમાં હુ'ઝ હુ થી ઓળખાય છે તેવા અનેક ચહેરાઓ અમેરિકાના સેક્સ ઓફેન્ડર જેફ્રી એપેસ્ટીનની ફાઈલોમાં જે રીતે સમાઈ ગયા છે અને હવે એક પછી એક ફાઈલ ઉખડતી જાય છે તેમ તેમ અત્યાર સુધી જેને ફક્ત એક સોશયલ ટેબુ જેવું ગણાતું હતું તે હવે વાસ્તવમાં અનેકની પોલીટીકલ કરીયર સામે પણ પ્રશ્ન સર્જી રહ્યા છે અને ધડાધડ રાજનામા પડી રહ્યા છે. વિશ્વમાં નૈતિકતામાં ભલે એપેસ્ટીન એ તળીયુ દેખાડ્યુ હોય પરંતુ ટોચના લોકો માટે તે એક સૌથી મોટી ચિંતા બની ગઈ છે અને જ્યાં માફી કામ તેમ નથી ત્યાં રાજનામા પડવા લાગ્યા છે અને હજુ થોડા વધુ આંચકા સહન કરવા પડે તો આશ્ચર્ય થશે નહીં ખાસ કરીને દુનિયાના અનેક ટોચના રાજકીય નેતાઓ અને તેમના ધનવાન મિત્રોની એક દુનિયા કેવી હતી તે પણ એપેસ્ટીન સાથે સંબંધો ધરાવતા એપેસ્ટીન ફાઈલથી બહાર આવ્યું છે

એક સમયના સેક્સ ઓફેન્ડર જેફ્રી એપેસ્ટીનની ફાઈલોમાં લાખો પાનાઓ જેમ જેમ ખુલતા જાય છે તેમ તેમ વધુને વધુ દિગ્ગજોના નામ બહાર આવી રહ્યા છે



બાંગ્લાદેશમાં યોજાઈ રહેલી વચગાળાની ચૂંટણીનું પ્રચાર અભિયાન જોર પકડી રહ્યું છે. કક્કરવાડી પરિબળો સત્તા હાંસલ કરવા મેદાનમાં આવ્યા છે. ઢાકા સ્થિત જમાત એ ઈસ્લામ પાર્ટીની યોજાવેલી ચૂંટણી રેલીને પાર્ટીના નેતા શફિફુર રહમાન સંબોધી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ૧૦ વિમાનો તોડી પાડ્યા

વોશિંગ્ટન, તા.૧૧ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ગયા મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંને દેશો પરમાણુ યુદ્ધ નરફ આગળ વધી રહ્યા હતા. ફીક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ટેરિફની ધમકીનો ઉપયોગ કરીને સંભવિત પરમાણુ યુદ્ધ ટાળ્યું હતું.

તેમણે એક નવો દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચેના યુદ્ધમાં ૧૦ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે તેમણે તેમના બીજા કાર્યકાળ દરમિયાન આઠ યુદ્ધો રોક્યા હતા, જેમાંથી

ઓછામાં ઓછા ૬ ટેરિફના વ્યુહાત્મક ઉપયોગ દ્વારા ઉકેલાયા હતા. ટ્રમ્પે વારંવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો અટકાવવાનો શ્રેય પોતાને આપ્યો છે. જોકે, ભારતે યુદ્ધ રોકવામાં કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકાનો ઇનકાર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મેં આઠ યુદ્ધો ઉકેલ્યા છે. તેમાંથી ઓછામાં ઓછા ૬ ટેરિફને કારણે ઉકેલાયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, મેં કહ્યું કે, જો તમે આ યુદ્ધનો ઉકેલ નહીં લાવો, તો હું તમારા પર ટેરિફ લગાવીશ કારણ કે હું નથી ઇચ્છતો કે લોકો મરે. ટ્રમ્પે મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી મુકાબલાનો ઉલ્લેખ

પાક. સંરક્ષણ મંત્રીએ પોતાના દેશની જ ફજેતી કરી:

અમેરિકાએ અમારો ટોઈલેટ પેપરની જેમ ઉપયોગ કર્યો

ઈસ્લામાબાદ, તા.૧૧ : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પોતાના જ દેશની ફજેતી કરીને અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે નેશનલ એસેમ્બલીમાં તાલિબાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે અફઘાનિસ્તાનમાં બે યુદ્ધો થયા ત્યારે પાકિસ્તાને ઈસ્લામની રક્ષા કરવા માટે યુદ્ધમાં ભાગ લીધો ન હતો. તેમણે પાકિસ્તાની કર્તૃત્વનો ભાંડો ફોડ્યો છે અને કહ્યું છે કે, અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાને પોતાના જ લોકોને જેલદના નામે મોતના મુખમાં ધકેલી દીધા હતા, તેમ છતાં પાકિસ્તાને કંઈ શીખ્યું નહીં. પાક. સંરક્ષણ મંત્રીએ પોતાના દેશની ખૂબ જ ખરાબ રીતે ફજેતી કરી છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકાએ

અને જો થોડા દિવસમાં બ્રિટનમાં વડાપ્રધાન કીર સ્ટારમરનું રાજીનામું આવી પડે તો આશ્ચર્ય થશે નહીં તેમના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકેસ્વીની ઉપરાંત તેમના સલાહકાર એડમ પેરી અને મેડવસન એ તો રાજીનામા આપી જ દીધા છે. લેબર પાર્ટિમાં સ્ટારમર પર જબરૂ દબાણ

વિશ્વમાં નૈતિકતામાં ભલે એપેસ્ટીને તળીયુ દેખાડ્યુ હોય પરંતુ ટોચના લોકો માટે તે એક સૌથી મોટી ચિંતા બની ગઈ છે

એક સમયના સેક્સ ઓફેન્ડર જેફ્રી એપેસ્ટીનની ફાઈલોમાં લાખો પાનાઓ જેમ જેમ ખુલતા જાય છે તેમ તેમ વધુને વધુ દિગ્ગજોના નામ બહાર આવી રહ્યા છે

જાણ હતી. તેમ છતાં તેઓએ આ નિયુક્તિ કરી તે દર્શાવે છે કે તેઓએ જે રીતે પોતાના ચીફ ઓફ સ્ટાફની સલાહ પર ગયા તે ખોટું હતું અને આ મુદ્દે હવે લેબર પાર્ટી તેમને કેટલું માફ કરશે તે પ્રશ્ન છે. તો બીજી

તરફ જોડર્નમાં નોર્વેના રાજદ્રુત મોના જુલએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોર્વેના કાઉન પ્રિન્સેસ મેટે-મારીટના સંબંધો બહાર આવ્યા બાદ તેઓને માફી માંગવાની ફરજ પડી તો ફ્રાન્સના પૂર્વ સંસ્કૃતિક મંત્ર જોર્જલેનને પણ રાજીનામું આપવું

પડ્યું છે અને આ યાદી એ એટલી લાંબી છે કે કદાચ તેમાં કદાચ દુનિયામાં સૌથી વધુ જો કોઈ વિવાદ પેદા કર્યો હશે. બ્રિટનના શાહી કુટુંબને પણ આ ફાઈલે પરેશાન કરી દીધા છે જેમાં રાજા ચાર્લ્સના નાના ભાઈ

એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરની આચરણની ભૂમિકા અંગે હવે પોલીસ તપાસ થશે અને ખુદ શાહી કુટુંબના આ ફરજન્ટ પોલીસ તપાસમાં સહયોગ આપવો પડશે. બ્રિટીશ પોલીસ પણ બિન્દાસ રીતે અને કોઈપણ ચિંતા કર્યા વગર આ તપાસ

જો એચ-1B વીઝા ૨૬ થાય તો ભારતીય પ્રોફેશનલ્સ અને આઈટી ટેક પર પડે મોટી અસર

વોશિંગ્ટન (અમેરિકા) તા.૧૧ ગત વર્ષે ટ્રમ્પ સરકારે ૨૧ સાપ્ટેમ્બરે એચ-વન બી વિઝાની ફી ૧ લાખ ડોલર (લગભગ ૮૮ લાખ રૂપિયા) કરીને ઝટકો આપ્યો હતો. હવે ટ્રમ્પ સરકારની વધુ એક ઝટકો આપવાની તૈયારી છે, જે મુજબ એચ-વન બી વીઝા બંધ કરી દેવાની હિલચાલ થઈ રહી છે. એક રિપબ્લીકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટ્યુબીએ અમેરિકામાં એચ-વન બી વિઝા ખતમ કરવા માટે એક નવું વિધેયક સોમવારે રજુ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એચ-વન બી વિઝા અમેરિકી કામદારો કરતા વિદેશીઓને વધુ પ્રાથમિકતા આપે છે. આથી

સ્થાનિક લોકોને નુકશાન થાય છે. આ પ્રસ્તાવિત કાયદાનું નામ છે. એન્ડીંગ એક્ટવાઈટીટીવ ઈમ્પોર્ટેડ લેબર એએમ્પ્લાસ એક્ટ, જેને સંક્ષેપમાં ‘એકઝાઈલ એક કહેવામાં આવે છે. ભારતીય પ્રોફેશનલ્સ પર પડશે સીધી અસર: એચ-વન બી વિઝાનો સૌથી વધુ ઉપયોગ ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકામાં કામ અને રહેવા માટે કરે છે. અચિક્રિત દાવા અનુસાર એચ-વન બી વિઝા મેળવનારાઓમાં ૭૦ ટકાથી વધુ ભારતીય છે. આ બિલની સીધી અસર ભારતીય આઈટી અને ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે.

જાહેર સૂચના
ફોર્મ નં. URC-2

પ્રકરણ XXXA ના ભાગ ૧૬૬૭ નોંધણી વિશે નોટિસ આપતી જાહેરાત (કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૩૭૪ (બી) અને કંપનીઓના નિયમ ૪ (૧) અનુસાર (નોંધણી માટે અધિકૃત) નિયમો, ૨૦૧૪)

૧. આથી નોટિસ આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૩૬૬ ની પેટા કલમ (૨) ના અનુસંધાનમાં, આ તારીખના પંદર દિવસ પછી પસંદ આ પછીના નીસ દિવસની સમાપ્તિ પહેલાં, સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર (સીઆરસી), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ એફસી (આઈઆઈસીએ), પ્લોટ નં. ૬, ૭, ૮, સેક્ટર ૫, આઇએમટી મનેસર, જિલ્લો ગુરુગ્રામ (હરિયાણા), પિન કોડ - ૧૨૨૦૫૦ ખાતે રજિસ્ટ્રાર સમક્ષ અરજી કરવામાં આવી છે કે સ્ટ્રેટિફાઇ વેલ્યુઅર્સ સર્વિસીસ એવએલપી. એક લિમિટેડ લીયાબીલિટી પાર્ટનરશિપ પેઢી, કંપની અધિનિયમ, ૨૦૧૩ ના પ્રકરણ XXXA ના ભાગ ૧૬૬૭ થી દ્વારા મર્યાદિત કંપની તરીકે નોંધણી કરાવી શકાય છે.


૨. પ્રસ્તાવિત કંપનીના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે: વિવિધ નાણાકીય ઉત્પાદનોના ફન્ડલ્સનીનો વ્યવસાય ચાલુ રાખવો અને મ્યુચ્યુઅલ ફંડ વિતરક અથવા અન્ય કોઈપણ વ્યવસાય અને કોઈપણ અન્ય આનુષંગિક વ્યવસાય તરીકે કાર્ય કરવું.

૩. પ્રસ્તાવિત કંપનીના મેમ્બરેડ્સ અને આર્ટિકલ ઓફ એસોસિએશનના ફાઉન્ડની નકલ ૩૭૩/૩૮, બી.લ્લોક, બીજી માળ, અજંતા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઈન્ડિયન નજીક, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૬, ગુજરાત, ભારત ખાતેની કચેરીમાં તપાસી શકાય છે.

૪. આથી સૂચના આપવામાં આવે છે કે આ અરજી સામે લાંબો ઉઠાવનાર કોઈપણ વ્યક્તિ આ સૂચનાના પ્રકાશન તારીખથી એકવીસ દિવસની અંદર સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર (સીઆરસી), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ એફસી (આઈઆઈસીએ), પ્લોટ નં. ૬, ૭, ૮, સેક્ટર ૫, આઇએમટી મનેસર, જિલ્લો ગુરુગ્રામ (હરિયાણા), પિન કોડ - ૧૨૨૦૫૦ ખાતે રજિસ્ટ્રારને લેખિતમાં તેમનો લાંબો જણાવી શકે છે, જેની નકલ કંપની ને તેની રજિસ્ટર્ડ એડ્રેસમાં આપવા આવી છે

તારીખ: ૧૧.૦૨.૨૦૨૬
સ્થળ: અમદાવાદ

અરજદારનું નામ
દિનેશભાઈ શક્તિભાઈ પટેલ



AMANTA

HEALTHCARE LIMITED

CIN: L24139GJ1994PLC023944

Regd. Office: 8th Floor, Shaligram Corporates C.J. Marg, Ambli, Ahmedabad - 380058, Gujarat, India.

Website: www.amanta.co.in, E-mail: info@amanta.co.in, Tel: +91 79 6777 7600

Statement Of Unaudited Financial Results For The Quarter And Nine Months Ended On December 31, 2025

(₹ in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended			Nine Months Ended		Year Ended
		31.12.2025	30.09.2025	31.12.2024	31.12.2025	31.12.2024	31.03.2025
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total income from operations	7,448.74	7,088.73	6,781.47	21,068.18	20,284.55	27,470.82
2	Net Profit for the period before tax	630.36	227.78	552.91	1,350.80	819.17	1,470.69
3	Net Profit for the period after tax	462.89	120.75	428.14	934.36	617.65	1,050.07
4	Total comprehensive income / (Loss) for the period (comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	452.85	110.73	423.11	904.26	592.99	1,009.95
5	Paid up equity share capital (F.V. of Rs. 10/- each)	343.36	343.36	282.70	343.36	282.70	282.70
6	Reserves excluding revaluation reserves as per balance sheet of previous accounting year						6,755.89
7	Earnings per share (of Rs. 10/- each) (not annualised)						
	Basic (Rs.) & Diluted (Rs.)	1.35	0.35	1.51	2.72	2.18	3.71

NOTE

The above financial results are prepared in compliance with Indian Accounting Standard ("Ind AS") as notified under section 133 of the Companies Act, 2013 ("the Act") [Companies (Indian Accounting Standards) Rules, 2015], as amended. The above financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on February 10, 2026.

The Company operates only in one business segment i.e. Manufacturing and sale of pharmaceutical products including contract manufacturing services provided to customer which constitutes single reportable segment in accordance with the requirements of Ind AS 108 "Operating Segments".

"On November 21, 2025, the Government of India notified the four consolidated Labour Codes, replacing several existing labour laws. Based on the draft rules and the guidance currently available, the Company has evaluated the impact of the revised definition of wages on its employee benefit obligations in accordance with Ind AS 19.


Following this assessment the incremental impact arising from the implementation of the Labour Codes is not material to its financial performance.

The Company will continue to monitor the finalisation of the relevant Central and State Rules and will recognise additional impact, if any, in the period in which such Rules or related clarifications are notified."

The above is the extract of detailed format of Financial Results for the Quarter and nine months ended December 31, 2025, filed with the Stock Exchanges under regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Financial Results is available on the website of BSE (www.bseindia.com), NSE (www.nseindia.com) and Company's website viz. www.amanta.co.in. and can also be accessed through the QR code given below.

Place: Ahmedabad

Date: February 10, 2026



For Amanta Healthcare Limited

Sd/-

Bhavesh Patel

Chairman & Managing Director (DIN: 00065505)



દક્ષિણ થાઈલેન્ડના હાટ યાઈમાં એક ડેકેર સેન્ટરમાં ઘુસી ૧૮ વર્ષના યુવકે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૩ લોકો ઘાયલ થયા હતા, એક મહિલાને બંધક બનાવી હતી હુમલાખોરની ધરપકડ કરી મહિલાને મુક્ત કરાઈ હતી આ ઘટનાને પગલે ડેકેર સેન્ટરમાં નાસભાગ મચી ગઈ હતી.

એક મહિલાને બંધક બનાવી લીધી હતી

થાઈલેન્ડમાં ડેકેર સેન્ટરમાં ફાયરિંગ; ત્રણ ઘાયલ, આરોપીની ધરપકડ

હાટ યાઈ, તા. ૧૧ થાઈલેન્ડમાં દક્ષિણ થાઈલેન્ડના હાટ યાઈમાં એક ૧૮ વર્ષીય વ્યક્તિએ શાળામાં ગોળીબાર કર્યો છે, સોગખલા પ્રાંતની એક શાળામાં ૧૮ વર્ષીય બંદૂકધારી યુવક શાળામાં બંદૂક લઈને પહોંચ્યો હતો. જ્યાં તેને બહેનને સજા આપનાર શિક્ષકને શોધવા એમ-૪ ગનથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો ગંભીર

રીતે ઘાયલ થયા હતા અને એક મહિલા કર્મચારીને બંધક બનાવી લીધી હતી.

બહેનને શિક્ષા કરનાર શિક્ષકને શોધવા ગન લઈને આવેલા ૧૮ વર્ષીય યુવકે ફાયરિંગ કરતા હડકપ

દક્ષિણ થાઈલેન્ડના સોગખલા પ્રાંતમાં બુધવારે એક

બંદૂકધારીએ એક શાળામાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ લોકો ઘાયલ થયા છે. અન્ય એક અધિકારીએ રોઈટર્સ ન્યૂઝ એ જન્સીને જણાવ્યું હતું કે બંદૂકધારીની અટકાયત કરવામાં આવી છે અને તેણે જે બંધકોને રાખ્યા હતા તે બધાને મુક્ત કરવામાં આવ્યા છે.

TIRUPATI FOAM LIMITED						
Regd. Off : "TIRUPATI" House, 4th Floor, Nr. Topaz Restaurant, University Road, Polytechnic Char Rasta, Ambawadi, Ahmedabad-380015. Gujarat, INDIA.						
CIN: L25199GJ1986PLC009071						
Email Id: tirufoam@tirupatifoam.com Website: www.tirupatifoam.com, www.sweetdreamindia.com Telephone: 26304652 53 54 55						
STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER ENDED 31ST DECEMBER, 2025						
PART I						
(AMOUNT IN LAKHS)						
Sr. No.	Particulars	Quarter Ended			Half Yearly	
		Unaudited Quarter Ended	Unaudited Quarter Ended	Unaudited Quarter Ended	Unaudited Quarter Ended	Audited Year Ended
		31.12.2025	30.09.2025	31.12.2024	31.12.2025	31.12.2024
1	Revenue From Operation					
	Total Revenue (a+b)	2484.65	2298.97	3077.54	7088.93	7867.49
2	Expenses					
	Total Expenses	2428.61	2226.30	3003.42	6902.46	7670.03
3	Profit (Loss) before exceptional items and tax	56.04	72.67	74.12	186.47	197.46
5	Profit (Loss) before Taxes	56.04	72.67	74.12	186.47	197.46
6	Total Tax Expenses	12.00	17.95	14.54	45.33	46.05
7	Net Profit / (Loss) from ordinary activities after tax (5-6)	44.03	54.72	59.58	141.14	151.41
8	Total Other Comprehensive Income	0.50	0.50	0.27	1.49	0.82
9	Total Comprehensive Income for the period (7+8)	44.53	55.21	59.85	142.63	152.23
10	Paid up Equity Share Capital (face value of Rs. 10/- each)	440.07	440.07	440.07	440.07	440.07
11	Basic and Diluted EPS (Rs.)					
	Basic	1.00	1.24	1.35	3.20	3.44
	Diluted	1.00	1.24	1.35	3.20	3.44
Note: The above is an extract of the detailed Unaudited Financial Results for quarter ended on December 31, 2025 filed with BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The format of the Financial Results are available of the stock exchange website at www.bseindia.com and also on Company's website www.tirupatifoam.com						
Place: Ahmedabad Date: 11.02.2026		For, Tirupati Foam Limited sd/- Roshan Sanghavi Managing Director				

AIROLAM

DECORATIVE LAMINATES

AIRO LAM LIMITED

CIN: L20211GJ2007PLC052019

Regd. Office : Survey No. 355, Nanapur Road, N.H. No. 8,
Village- Dajpur, Ta. Prentij, Himatnagar - 383120, Gujarat, India.

Phone No. +91 2770-240572/73, E-mail : cs1@airolam.com, Website : www.airolam.com

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUATER ENDED DECEMBER 31, 2025

(Amount In Lakh Rupees)

PARTICULARS	Quarter ended			Nine Month Ended		Year Ended
	31-Dec-25	30-Sep-25	31-Dec-24	31-Dec-25	31-Dec-24	31-Mar-25
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Revenue	6,993.65	6,184.42	5,420.57	18,585.33	15,978.30	21,676.11
Profit before exceptional and extraordinary items and tax	186.26	274.72	137.47	642.03	85.68	424.59
Exceptional Items	--	--	--	--	--	--
Profit before tax	186.26	274.72	137.47	642.03	85.68	424.59
Profit (Loss) for the period	139.53	237.30	109.08	499.78	(7.77)	270.32
Total Comprehensive Income	145.11	234.29	100.67	506.24	25.99	282.81
Paid up Equity Share Capital (Equity Shares of Rs. 10/- each)	1,500.20	1,500.20	1,500.20	1,500.20	1,500.20	1,500.20
Earning per share (In INR)						
1) Basic	0.93	1.58	0.73	3.33	(0.05)	1.80
2) Diluted	0.93	1.58	0.73	3.33	(0.05)	1.80

The above unaudited consolidated financial results of the Company have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on February 11, 2026.

Additional Information related to Standalone Financial Results:

(Amount in Lakh Rupees)

PARTICULARS	Quarter ended			Nine Month Ended		Year Ended
	31-Dec-25	30-Sep-25	31-Dec-24	31-Dec-25	31-Dec-24	31-Mar-25
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Revenue	6,982.82	6,250.79	5,521.02	18,559.32	15,962.82	21,687.97
Profit before exceptional and extraordinary items and tax	204.74	306.83	152.01	715.06	161.45	507.97
Exceptional Items	--	--	--	--	--	--
Profit before tax	204.74	306.83	152.01	715.06	161.45	507.97
Profit (Loss) for the period	158.01	269.41	123.62	572.81	68.00	353.69
Total Comprehensive Income	163.59	266.40	115.21	579.27	101.76	366.18
Paid up Equity Share Capital (Equity Shares of Rs. 10/- each)	1,500.20	1,500.20	1,500.20	1,500.20	1,500.20	1,500.20
Earning per share (In INR)						
1) Basic	1.05	1.80	0.82	3.82	0.45	2.36
2) Diluted	1.05	1.80	0.82	3.82	0.45	2.36

Note: The above is an extract of the detailed format of unaudited Consolidated quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited quarterly Financial Results (Consolidated and Standalone) are available on Company's website- www.airolam.com and also on the website of the stock exchange i.e. NSE Limited- www.nseindia.com.

For Airolam Limited

Place : Ahmedabad, Date : 11.02.2026

Sd/-, Pravin Kumar N. Patel, Managing Director